

## १ पितरस्य पत्रं

I पन्त-गालातिया-कप्पदकिया-आशिया-बिथुनियादेशेषु प्रवासिनो ये विकीर्णलोकाः

II पितुरीश्वरस्य पूर्वनिर्णयाद् आत्मनः पावनेन यीशुप्रीष्टस्याज्ञाग्रहणाय शोषितप्रोक्षणाय याभिरुचितास्तान् प्रति यीशुप्रीष्टस्य प्रेरितः पितरः पत्रं लिखति युष्मान् प्रति बाहुल्येन शान्तिरनुग्रहश्च भूयास्तां।

III अस्माकं प्रभो यीशुप्रीष्टस्य तात ईश्वरो धन्यः, यतः स स्वकीयबहुकृपातो मृतगणमध्याद् यीशुप्रीष्टस्योत्थानेन श्रुवनप्रत्याशार्थम् अर्थतो

IV ऽक्षयनिष्कलङ्काम्लानसम्पत्तिप्राप्त्यर्थम् अस्मान् पुन र्जनयामासा सा सम्पत्तिः स्वर्गो ऽस्माकं कृते सञ्चिता तिष्ठति,

V यूयञ्चेश्वरस्य शक्तितः शेषकाले प्रकाश्यपरित्राणार्थं विश्वासेन रक्ष्यध्वे।

VI तस्माद् यूयं यद्यप्यानन्देन प्रकुल्ला भवथ तथापि साम्प्रतं प्रयोजनहेतोः कियत्कालपर्यन्तं नानाविधपरीक्षाभिः क्लिश्यध्वे।

VII यतो वह्निना यस्य परीक्षा भवति तस्मात् नश्वरसुवर्णादपि बहुमूल्यं युष्माकं विश्वासरूपं यत् परीक्षितं स्वर्णं तेन यीशुप्रीष्टस्यागमनसमये प्रशंसायाः समाहरस्य गौरवस्य य योग्यता प्राप्तव्या।

VIII यूयं तं प्रीष्टम् अदृष्ट्वापि तस्मिन् प्रीयध्वे साम्प्रतं तं न पश्यन्तोऽपि तस्मिन् विश्वसन्तो ऽनिर्व्वयनीयेन प्रभावयुक्तेन यानन्देन प्रकुल्ला भवथ,

IX स्वविश्वासस्य परिणामरूपम् आत्मनां परित्राणं लभध्वे या

X युष्मासु यो ऽनुग्रहो वर्त्तते तद्विषये य ईश्वरीयवाक्यं कथितवन्तस्ते भविष्यद्वादिनस्तस्य परित्राणस्यान्वेषणम् अनुसन्धानञ्च कृतवन्तः।

XI વિશેષતસ્તેષામન્તર્વ્વાસી યઃ ખ્રીષ્ટસ્યાત્મા ખ્રીષ્ટે વર્તિષ્યમાણાનિ દુઃખાનિ તદનુગામિપ્રભાવઞ્ચ પૂર્વ્વ પ્રાકાશયત્ તેન કઃ કીદૃશો વા સમયો નિરદિશ્યતૈતસ્યાનુસન્ધાનં કૃતવન્તઃ।

XII તતસ્તૈ વિષયૈસ્તે યન્ન સ્વાન્ કિન્ત્વસ્માન્ ઉપકુર્વ્વન્ત્યેતત્ તેષાં નિકટે પ્રાકાશયતા યાંશ્ચ તાન્ વિષયાન્ દિવ્યદ્હૂતા અપ્યવનતશિરસો નિરીક્ષિતુમ્ અભિલષન્તિ તે વિષયાઃ સામ્પ્રતં સ્વર્ગાત્ પ્રેષિતસ્ય પવિત્રસ્યાત્મનઃ સહાય્યાદ્ યુષ્મત્સમીપે સુસંવાદ્મચારયિતૃભિઃ પ્રાકાશ્યન્તા।

XIII અતએવ યૂયં મનઃકટિબન્ધનં કૃત્વા પ્રબુદ્ધાઃ સન્તો યીશુખ્રીષ્ટસ્ય પ્રકાશસમયે યુષ્માસુ વર્તિષ્યમાનસ્યાનુગ્રહસ્ય સમ્પૂર્ણાં પ્રત્યાશાં કુરુતા।

XIV અપરં પૂર્વ્વાયાજ્ઞાનતાવસ્થાયાઃ કુત્સિતાભિલાષાણાં યોગ્યમ્ આચારં ન કુર્વ્વન્તો યુષ્મદાહ્વાનકારી યથા પવિત્રો ડસ્તિ।

XV યૂયમધ્યાજ્ઞાગ્રાહિસન્તાના ઇવ સર્વ્વસ્મિન્ આચારે તાદૃક્ પવિત્રા ભવતા।

XVI યતો લિખિતમ્ આસ્તે, યૂયં પવિત્રાસ્તિષ્ઠત યસ્માદહં પવિત્રઃ।

XVII અપરઞ્ચ યો વિનાપક્ષપાતમ્ એકૈકમાનુષસ્ય કર્માનુસારાદ્ વિચારં કરોતિ સ યદિ યુષ્માભિસ્તાત આપ્યાયતે તર્હિ સ્વપ્રવાસસ્ય કાલો યુષ્માભિ ભીંત્યા યાપ્યતાં।

XVIII યૂયં નિરર્થકાત્ પૈતૃકાચારાત્ ક્ષયણીયૈ રૂપ્યસુવર્ણાદિભિ મુક્તિં ન પ્રાપ્ય।

XIX નિષ્કલકુનિર્મલમેષશાવકસ્યેવ ખ્રીષ્ટસ્ય બહુમૂલ્યેન રુધિરેણ મુક્તિં પ્રાપ્તવન્ત ઇતિ જ્ઞાનીથા।

XX સ જગતો ભિન્તિમૂલસ્થાપનાત્ પૂર્વ્વ નિયુક્તઃ કિન્તુ ચરમદિનેષુ યુષ્મદર્થ પ્રકાશિતો ડભવત્।

XXI યતસ્તેનૈવ મૃતગણાત્ તસ્યોત્થાપયિતરિ તસ્મૈ ગૌરવદાતરિ ચેશ્વરે વિશ્વસિથ તસ્માદ્ ઈશ્વરે યુષ્માકં વિશ્વાસઃ પ્રત્યાશા યાસ્તે।

XXII યૂયમ્ આત્મના સત્યમતસ્યાજ્ઞાગ્રહણદ્વારા નિષ્કપટાય ભ્રાતૃપ્રેમ્ને પાવિતમનસો ભૂત્વા નિર્મલાન્તઃકરણૈઃ પરસ્પરં ગાઢં પ્રેમ કુરુતા।

XXIII यस्माद् यूयं क्षयाणीयवीर्यात् नहि किन्त्वक्षयाणीयवीर्याद् ईश्वरस्य श्रवणनदायकेन नित्यस्थायिना वाक्येन पुनर्जन्म गृहीतवन्तः।

XXIV सर्व्वप्राणी तृणैस्तुल्यस्तत्तेजस्तृणपुष्पवत्। तृणानि परिशुष्यति पुष्पाणि निपतन्ति या

XXV किन्तु वाक्यं परेशस्यानन्तकालं वितिष्ठते। तदेव य वाक्यं सुसंवादेन युष्माकम् अन्तिके प्रकाशितं।

## II

I सर्व्वान् द्वेषान् सर्व्वान् एलान् कापट्यानीर्ष्याः समस्तग्लानिकथाश्च दूरीकृत्य

II युष्माभिः परित्राणाय वृद्धिप्राप्त्यर्थं नवजातशिशुभिरिव प्रकृतं वाग्दुग्धं पिपास्यतां।

III यतः प्रभु र्मधुर अेतस्यास्वादं यूयं प्राप्तवन्तः।

IV अपरं मानुषैरवज्ञातस्य किन्त्वीश्वरेणाभिरुचयितस्य बहुमूल्यस्य श्रवणप्रस्तरस्येव तस्य प्रभोः सन्निधिम् आगत।

V यूयमपि श्रवणप्रस्तरा एव नियीयमाना आत्मिकमन्दिरं प्रीष्टेन यीशुना येश्वरतोषकाणाम् आत्मिकबलीनां दानार्थं पवित्रो याजकवर्गो भवथा।

VI यतः शास्त्रे लिपितमास्ते, यथा, पश्य पाषाण अेको ऽस्ति सीथोनि स्थापितो मया। मुष्यकोणस्य योग्यः स वृत्तश्चातीव मूल्यवान् यो ज्ञो विश्वसेत् तस्मिन् स लज्जानं न गमिष्यति।

VII विश्वासिनां युष्माकमेव समीपे स मूल्यवान् भवति किन्त्वविश्वासिनां कृते नियेतृभिरवज्ञातः स पाषाणः कोणस्य भित्तिमूलं भूत्वा बाधाज्जकः पाषाणः स्फलनकारकश्च शैलो ज्ञातः।

VIII ते याविश्वासाद् वाक्येन स्फलन्ति स्फलने य नियुक्ताः सन्ति।

IX किन्तु यूयं येनान्धकारमध्यात् स्वकीयाश्चर्य्यदीप्तिमध्यम् आहूतास्तस्य गुणान् प्रकाशयितुम् अभिरुचयितो वंशो राजकीयो याजकवर्गः पवित्रा ज्ञातिरधिकर्त्तव्याः प्रजाश्च ज्ञाताः।

X पूर्व्वं यूयं तस्य प्रजा नाभवत किन्त्विदानीम् ईश्वरस्य प्रजा आध्वे पूर्व्वम् अननुकम्पिता अभवत किन्त्विदानीम् अनुकम्पिता आध्वे।

XI હે પ્રિયતમાઃ, યૂયં પ્રવાસિનો વિદેશિનશ્ચ લોકા ઇવ મનસઃ પ્રાતિકૂલ્યેન યોધિભ્યઃ શારીરિકસુખાભિલાષેભ્યો નિવર્તધ્વમ્ ઇત્યહં વિનયો

XII દેવપૂજકાનાં મધ્યે યુષ્માકમ્ આચાર એવમ્ ઉત્તમો ભવતુ યથા તે યુષ્માન્ દુષ્કર્મકારિલોકાનિવ પુન ન નિન્દન્તઃ કૃપાદૃષ્ટિદિને સ્વયક્ષુર્ગોચરીયસત્ક્રિયાભ્ય ઈશ્વરસ્ય પ્રશંસાં કુર્યુઃ।

XIII તતો હેતો યૂયં પ્રભોરનુરોઘાત્ માનવસૃષ્ટાનાં કર્તૃત્વપદાનાં વશીભવત વિશેષતો ભૂપાલસ્ય યતઃ સ શ્રેષ્ઠઃ,

XIV દેશાઘ્યક્ષાણાશ્ચ યતસ્તે દુષ્કર્મકારિણાં દણ્ડદાનાર્થ સત્કર્મકારિણાં પ્રશંસાર્થશ્ચ તેન પ્રેરિતાઃ।

XV ઇત્યં નિર્બોધમાનુષાણામ્ અજ્ઞાનત્વં યત્ સદાચારિભિ યુષ્માભિ નિરુત્તરીક્રિયતે તદ્ ઈશ્વરસ્યાભિમતાં

XVI યૂયં સ્વાધીના ઇવાચરત તથાપિ દુષ્ટતાયા વેષસ્વરૂપાં સ્વાધીનતાં ધારયન્ત ઇવ નહિ કિન્ત્વીશ્વરસ્ય દાસા ઇવા

XVII સર્વાન્ સમાદ્રિયધ્વં ભ્રાતૃવર્ગે પ્રીયધ્વમ્ ઈશ્વરાદ્ બિભીત ભૂપાલં સમ્મન્યધ્વાં

XVIII હે દાસાઃ યૂયં સમ્પૂર્ણાદિરેણ પ્રભૂનાં વશ્યા ભવત કેવલં ભદ્રાણાં દયાલૂનાશ્ચ નહિ કિન્ત્વનૃજૂનામપિ

XIX યતો ડન્યાયેન દુઃખભોગકાલ ઈશ્વરચિન્તયા યત્ કલેશસહનં તદેવ પ્રિયં

XX પાપં કૃત્વા યુષ્માકં ચપેટાઘાતસહનેન કા પ્રશંસા? કિન્તુ સદાચારં કૃત્વા યુષ્માકં યદ્ દુઃખસહનં તદેવેશ્વરસ્ય પ્રિયં

XXI તદર્થમેવ યૂયમ્ આહૂતા યતઃ પ્ત્રીષ્ટોડપિ યુષ્મન્નિમિત્તં દુઃખં ભુક્ત્વા યૂયં યત્ તસ્ય પદચિહ્નૈ વ્રજેત તદર્થં દૃષ્ટાન્તમેકં દર્શિતવાન્

XXII સ કિમપિ પાપં ન કૃતવાન્ તસ્ય વદને કાપિ છલસ્ય કથા નાસીત્

XXIII નિન્દિતો ડપિ સન્ સ પ્રતિનિન્દાં ન કૃતવાન્ દુઃખં સહમાનો ડપિ ન ભર્ત્સિતવાન્ કિન્તુ યથાર્થવિચારચિતુઃ સમીપે સ્વં સમર્પિતવાન્

XXIV वयं यत् पापेभ्यो निवृत्य धर्मार्थं श्रुवामस्तदर्थं स स्वशरीरेणास्माकं पापानि कुश उढवान् तस्य प्रहारै र्युयं स्वस्था अभवत्।

XXV यतः पूर्व युयं भ्रमणकारिभेषा एवाध्वं किन्त्वधुना युष्माकम् आत्मनां पालकस्याध्यक्षस्य य समीपं प्रत्यावर्तिताः।

### III

I हे योषितः, यूयमपि निजस्वामिनां वश्या भवत तथा सति यद्दि केयिद् वाक्ये विश्वासिनो न सन्ति तर्हि

II ते विनावाक्यं योषिताम् आचारेषार्थतस्तेषां प्रत्यक्षेण युष्माकं सभयसतीत्वाचारेणाकृष्टं शक्यन्ते।

III अपरं केशरयनया स्वर्णालङ्कारधारणो परिच्छेदपरिधानेन वा युष्माकं वाद्यभूषा न भवतु,

IV किन्त्वीश्वरस्य साक्षाद् बहुमूल्यक्षमाशान्तिभावाक्षयरत्नेन युक्तो गुप्त आन्तरिकमानव एव।

V यतः पूर्वकाले याः पवित्रस्त्रिय ईश्वरे प्रत्याशामकुर्वन् ता अपि तादृशीभेव भूषां धारयन्त्यो निजस्वामिनां वश्या अभवन्।

VI तथैव सारा एवमाडीभो वश्या सती तं पतिमाभ्यातवती यूयञ्च यद्दि सदाचारिण्यो भवथ व्याकुलतया य भीता न भवथ तर्हि तस्याः कन्या आध्वे।

VII हे पुरुषाः, यूयं ज्ञानतो दुर्बलतरमाज्जनैरिव योषिद्धिः सडवासं कुरुत, ऐकस्य श्रुवनवरस्य सडभागिनीभ्यताभ्यः समाहरं वितरत य न येद् युष्माकं प्रार्थनानां बाधा जनिष्यते।

VIII विशेषतो यूयं सर्व्व ऐकमनसः परदुःखै र्दुःखिता भ्रातृप्रमिणः कृपावन्तः प्रीतिभावाश्च भवत।

IX अनिष्टस्य परिशोधेनानिष्टं निन्द्याया वा परिशोधेन निन्दां न कुर्वन्त आशिषं दत्त यतो यूयम् आशिरधिकारिणो भवितुमाहूता एति ज्ञानीथा।

X अपरञ्च, श्रुवने प्रीयमाणो यः सुदिनानि दिदृक्षतो पापात् जिह्वां मृषावाक्यात् स्वाधरौ स निवर्त्तयेत्।

XI स त्यज्जेद् दृष्टतामार्गं सत्क्रियाञ्च समाचरेत् मृगयायाश्च शान्तिं स नित्यमेवानुधावतु।

XII लोचने परमेशस्योन्मीलिते धार्मिकान् प्रति प्रार्थनायाः कृते तेषाः तच्छ्रोत्रे सुगमे सद्यः क्रोधास्यञ्च परेशस्य कदाचारिषु वर्तते।

XIII अपरं यदि यूयम् उत्तमस्यानुगामिनो भवथ तर्हि को युष्मान् हिंसिष्यते?

XIV यदि य धर्मार्थं क्लिश्यध्वं तर्हि धन्या भविष्यथा तेषाम् आशङ्क्या यूयं न बिभीत न विड्कत वा।

XV मनोभिः किन्तु मन्यध्वं पवित्रं प्रभुमीश्वरं अपरञ्च युष्माकम् आन्तरिकप्रत्याशायास्तत्त्वं यः कश्चित् पृच्छति तस्मै शान्तिभीतिभ्याम् उत्तरं दातुं सद्यः सुसज्जता भवत।

XVI ये य प्रीष्टधर्मं युष्माकं सदाचारं दूषयन्ति ते दुष्कर्म्मकारिणामिव युष्माकम् अपवादेन यत् लज्जिता भवेयुस्तदर्थं युष्माकम् उत्तमः संवेदो भवतु।

XVII ईश्वरस्याभिमताद् यदि युष्माभिः क्लेशः सोढव्यस्तर्हि सदाचारिभिः क्लेशसहनं वरं न य कदाचारिभिः।

XVIII यस्माद् ईश्वरस्य सन्निधिम् अस्मान् आनेतुम् अधार्मिकाणां विनिमयेन धार्मिकः प्रीष्टो ऽप्येककृत्वः पापानां दण्डं भुक्तवान् स य शरीरसम्बन्धे मारितः किन्त्वात्मनः सम्बन्धे पुन ऋणितो ऽभवत्।

XIX तत्सम्बन्धे य स यात्रां विधाय काराबद्धानाम् आत्मनां समीपे वाक्यं घोषितवान्।

XX पुरा नोडस्य समये यावत् पोतो निरभीयत तावद् ईश्वरस्य दीर्घसहिष्णुता यद्य व्यलम्बत तदा तेऽनाज्ञाग्राहिणोऽभवन् तेन पोतोनाल्पेऽर्थाद् अष्टावेव प्राणिनस्तोयम् उत्तीर्णाः।

XXI तन्निदर्शनञ्चावगाहनं (अर्थतः शारीरिकमलिनताया यस्यागः स नहि किन्त्वीश्वरायोत्तमसंवेदस्य या प्रतज्ञा सैव) यीशुप्रीष्टस्य पुनरुत्थानेनेदानीम् अस्मान् उत्तारयति,

XXII यतः स स्वर्गं गत्वेश्वरस्य दक्षिणे विद्यते स्वर्गीयदूताः शासका बलानि य तस्य वशीभूता अभवन्।

## IV

I અસ્માકં વિનિમયેન પ્રીષ્ટઃ શરીરસમ્બન્ધે દણ્ડં ભુક્તવાન્ અતો હેતોઃ શરીરસમ્બન્ધે યો દણ્ડં ભુક્તવાન્ સ પાપાત્ મુક્ત

II ઇતિભાવેન યૂયમપિ સુસજ્જભૂય દેહવાસસ્યાવશિષ્ટં સમયં પુનર્માનવાનામ્ ઇચ્છાસાધનાર્થં નહિ કિન્ત્વીશ્વરસ્યેચ્છાસાધનાર્થં યાપયતા

III આયુષો યઃ સમયો વ્યતીતસ્તસ્મિન્ યુષ્માભિ ર્યદ્ દેવપૂજકાનામ્ ઇચ્છાસાધનં કામકુત્સિતાભિલાષમદાપાનરજ્જસમત્તાઘૃણાઈદેવપૂજાયરણાઞ્ચાકારિ તેન બાહુલ્યં

IV યૂયં તૈઃ સહ તસ્મિન્ સર્વ્વનાશપદ્ધે મજ્જિજતું ન ધાવથ, ઇત્યનેનાશ્ચર્યં વિજ્ઞાય તે યુષ્માન્ નિન્દન્તિ

V કિન્તુ યો જીવતાં મૃતાનાઞ્ચ વિચારં કર્તુમ્ ઉદાતોડસ્તિ તસ્મૈ તૈરુત્તરં દાયિષ્યતે

VI યતો હેતો ર્યે મૃતાસ્તેષાં યત્ માનવોદ્દેશ્યઃ શારીરિકવિચારઃ કિન્ત્વીશ્વરોદ્દેશ્યમ્ આત્મિકજીવનં ભવત્ તદર્થં તેષામપિ સન્નિઘૌ સુસમાચારઃ પ્રકાશિતોડભવત્

VII સર્વ્વેષામ્ અન્તિમકાલ ઉપસ્થિતસ્તસ્માદ્ યૂયં સુબુદ્ધયઃ પ્રાર્થનાર્થં જાગ્રતશ્ચ ભવત

VIII વિશેષતઃ પરસ્પરં ગાઢં પ્રેમ કુરુત, યતઃ, પાપાનામપિ બાહુલ્યં પ્રેમ્નૈવાચ્છાદયિષ્યતે

IX કાતરોક્તિં વિના પરસ્પરમ્ આતિથ્યં કુરુત

X યેન યો વરો લબ્ધસ્તેનૈવ સ પરમ્ ઉપકરોત્, ઇત્યં યૂયમ્ ઈશ્વરસ્ય બહુવિધપ્રસાદસ્યોત્તમા ભાણડાગારાધિપા ભવત

XI યો વાક્યં કથયતિ સ ઈશ્વરસ્ય વાક્યમિવ કથયતુ યશ્ચ પરમ્ ઉપકરોતિ સ ઈશ્વરદત્તસામર્થ્યાદિવોપકરોત્ સર્વ્વવિષયે યીશુપ્રીષ્ટેનેશ્વરસ્ય ગૌરવં પ્રકાશ્યતાં તસ્યૈવ ગૌરવં પરાક્રમશ્ચ સર્વ્વદા ભૂયાત્ આમેના

XII હે પ્રિયતમાઃ, યુષ્માકં પરીક્ષાર્થં યસ્તાપો યુષ્માસુ વર્તતે તમ્ અસમ્ભવઘટિતં મત્વા નાશ્ચર્યં જાનીત,

XIII किन्तु श्रीष्टेन क्लेशानां सङ्भागित्वाद् आनन्दत तेन तस्य प्रतापप्रकाशेऽध्याननन्देन प्रकुल्ला भविष्यथा

XIV यद्दि श्रीष्टस्य नामडेतुना युष्माकं निन्दा भवति तर्हि यूयं धन्या यतो गौरवदायक ईश्वरस्यात्मा युष्मास्वधितिष्ठति तेषां मध्ये स निन्दते किन्तु युष्मन्मध्ये प्रशंस्यते।

XV किन्तु युष्माकं कोऽपि छन्ता वा यैरो वा दुष्कर्म्मकृद् वा पराधिकारयर्थक एव दण्डं न भुङ्क्तां।

XVI यद्दि य श्रीष्टीयान एव दण्डं भुङ्क्ते तर्हि स न लज्जमानस्तत्कारणाद् ईश्वरं प्रशंसतु।

XVII यतो विचारस्यारम्भसमये ईश्वरस्य मन्दिरे युज्यते यद्दि यास्मत्स्वारभते तर्हीश्वरीयसुसंवादाग्राहिणां शेषदशा का भविष्यति?

XVIII धार्मिकेनापि येत् त्राणम् अतिकृच्छ्रेण गम्यते तर्ह्यधार्मिकपापिभ्याम् आश्रयः कुत्र लप्स्यते।

XIX अत ईश्वरेच्छातो ये दुःखं भुञ्जते ते सदायारेण स्वात्मानो विश्वास्यस्रष्टुरीश्वस्य कराभ्यां निदधतां।

## V

I श्रीष्टस्य क्लेशानां साक्षी प्रकाशिष्यमाणस्य प्रतापस्यांशी प्राचीनश्चाहं युष्माकं प्राचीनान् विनीयेहं वदामि।

II युष्माकं मध्यवर्ती य ईश्वरस्य भेषवृन्दो यूयं तं पालयत तस्य वीक्षणं कुरुत य, आवश्यकत्वेन नहि किन्तु स्वेच्छातो न व कुलोभेन किन्त्विच्छुक्मनसा।

III अपरम् अंशानाम् अधिकारिण एव न प्रभवत किन्तु वृन्दस्य दृष्टान्तस्वरूपा भवत।

IV तेन प्रधानपालक उपस्थिते यूयम् अम्बानं गौरवकिरीटं लप्स्यध्वे।

V हे युवानः, यूयमपि प्राचीनलोकानां वश्या भवत सर्व्वे य सर्व्वेषां वशीभूय नम्रताभरणेन भूषिता भवत, यतः, आत्मात्भिमानिलोकानां विपक्षो भवतीश्वरः। किन्तु तेनैव नम्रेभ्यः प्रसादाद् दीयते वरः।



VI અતો યૂયમ્ ઈશ્વરસ્ય બલવત્કરસ્યાધો નમ્રીભૂય તિષ્ઠત તેન સ ઉચિતસમયે યુષ્માન્ ઉચ્ચીકરિષ્યતિ

VII યૂયં સર્વચિન્તાં તસ્મિન્ નિક્ષિપત યતઃ સ યુષ્માન્ પ્રતિ ચિન્તયતિ

VIII યૂયં પ્રબુદ્ધા જાગ્રતશ્ચ તિષ્ઠત યતો યુષ્માકં પ્રતિવાદી યઃ શયતાનઃ સ ગજ્જનકારી સિંહ ઇવ પર્યટન્ કં ગ્રસિષ્યામીતિ મૃગયતે,

IX અતો વિશ્વાસે સુસ્થિરાસ્તિષ્ઠન્તસ્તેન સાર્દ્ધં યુધ્યત, યુષ્માકં જગન્નિવાસિભ્રાતૃષ્વપિ તાદૃશાઃ કલેશા વર્તન્ત ઇતિ જાનીતા

X ક્ષણિકદુઃખભોગાત્ પરમ્ અસ્મભ્યં પ્રીષ્ટેન યીશુના સ્વકીયાનન્તગૌરવદાનાર્થં યોડસ્માન્ આહૂતવાન્ સ સર્વાનુગ્રાહીશ્વરઃ સ્વયં યુષ્માન્ સિદ્ધાન્ સ્થિરાન્ સબલાન્ નિશ્ચલાંશ્ચ કરોતુ

XI તસ્ય ગૌરવં પરાક્રમશ્ચાનન્તકાલં યાવદ્ ભૂયાત્ આમેન્

XII યઃ સિલ્વાનો (મન્યે) યુષ્માકં વિશ્વાસ્યો ભ્રાતા ભવતિ તદ્વારાહં સંક્ષેપેણ લિખિત્વા યુષ્માન્ વિનીતવાન્ યૂયઞ્ચ યસ્મિન્ અધિતિષ્ઠથ સ એવેશ્વરસ્ય સત્યો ડનુગ્રહ ઇતિ પ્રમાણં દત્તવાન્

XIII યુષ્માભિઃ સહાભિરુચિતા યા સમિતિ બાંબિલિ વિદ્યતે સા મમ પુત્રો માર્કશ્ચ યુષ્માન્ નમસ્કારં વેદ્યતિ

XIV યૂયં પ્રેમયુગ્મબનેન પરસ્પરં નમસ્કુરુતા યીશુપ્રીષ્ટાશ્રિતાનાં યુષ્માકં સર્વેષાં શાન્તિ ભૂયાત્ આમેન્

## **Sanskrit Bible (NT) in Gujarati Script New Testament in Sanskrit Language; printed in Gujarati Script**

copyright © 2018 SanskritBible.in

Language: Sanskrit

Contributor: SanskritBible.in

Thank you for your interest in Sanskrit Bible.

Sanskrit Bible (NT) is freely available in 22 different scripts of your choice. This edition is in Gujarati script and is based on the Sanskrit translation of the Holy Bible published by Calcutta Baptist Missionaries in 1851. Please visit [SanskritBible.in](http://SanskritBible.in) to learn more about Sanskrit Bible and to download various free Christian literature.

This translation is made available to you under the terms of the Creative Commons Attribution Share-Alike license 4.0.

You have permission to share and redistribute this Bible translation in any format and to make reasonable revisions and adaptations of this translation, provided that:

You include the above copyright and source information.

If you make any changes to the text, you must indicate that you did so in a way that makes it clear that the original licensor is not necessarily endorsing your changes.

If you redistribute this text, you must distribute your contributions under the same license as the original.

Pictures included with Scriptures and other documents on this site are licensed just for use with those Scriptures and documents. For other uses, please contact the respective copyright owners.

Note that in addition to the rules above, revising and adapting God's Word involves a great responsibility to be true to God's Word. See Revelation 22:18-19.

2020-01-01

---

PDF generated using Haiola and XeLaTeX on 4 Mar 2023 from source files dated 29 Jan 2022

e1290797-4477-53f0-873d-c9153a72fd01